

M.A. Semester - 2 (CBCS) Examination
March/April -2019 (Old Course)
INDUSTRIAL ECONOMICS-2 (ELECTIVE)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	ભારતનાં ઔદ્યોગિક વિકાસમાં જાહેરક્ષેત્રનાં ફાળાની ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	ઔદ્યોગિક સ્થાનીયકરણને અસરકરતાં પરિબલોની વિગતે ચર્ચા કરો.	
પ્રશ્ન-૨	આલ્ફ્રેડ વેબરના ઔદ્યોગિક સ્થાનીયકરણના સિદ્ધાંતની સમજૂતી આપી તેની મર્યાદાઓ જણાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ ભારતના સંદર્ભમાં ચર્ચો.	
પ્રશ્ન-૩	ભારતીય અર્થકારણમાં નાના પાયાનાં ઉદ્યોગોનું મહત્વ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	ભારતમાં ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ અંગેની સરકારની નીતિ ચર્ચો.	
પ્રશ્ન-૪	ભારતમાં પ્રાદેશિક ઔદ્યોગિક અસમતુલાના કારણો ચર્ચો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	ભારતના ઔદ્યોગિક વિકાસમાં IDBIનો ફાળો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(૧) ઔદ્યોગિક આર્થિક સત્તાના કેન્દ્રીકરણના કારણો અને અસરો.	
	(૨) ઔદ્યોગિક નાણા વ્યવસ્થાના સ્ત્રોતો.	
	(૩) બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ટેકનોલોજીની તબદીલી.	
	(૪) વર્તમાન ઔદ્યોગિક વિકાસના વલણો.	

ENGLISH VERSION

Que-1	Discuss the role of public sector in industrial development in India.	(14)
	OR	
Que-1	Discuss in detail the factors effecting Industrial Location.	
Que-2	Explain the Industrial Location theory of Alfred Weber. Give in limitations.	(14)
	OR	
Que-2	Discuss the liberalization and privatization policy in Indian context.	
Que-3	Explain the importance of small scale industries in Indian Economy.	(14)
	OR	
Que-3	Discuss the Government Policy of Industrial pollution control in India.	
Que-4	Discuss the factors of regional industrial imbalance in India.	(14)
	OR	
Que-4	Roll of IDBI in industrial development in India.	
Que-5	Write short note. (any two)	(14)
	(1) Causes and effects of industrial Economic concentration.	
	(2) Sources of industrial finance.	
	(3) MNCs and transfer of technology.	
	(4) Recent trends in industrial growth.	
